

ଶ୍ରୀ ପାତ୍ର କାନ୍ତିଲାଲ ମହାନାନ୍ଦ ମହାନାନ୍ଦ ମହାନାନ୍ଦ ମହାନାନ୍ଦ

ନିୟ୍ୟ । ୨୧ । ଶୀତଦେଖିକା, ଏ.ସ. ପାଇୟାମାରୀ ।

— DELUXE —
PAGE NO. :
DATE

ચોમાસિ દુષ્યાદુન અંધન દુષ્યા દુષ્યામ. (પર્વતિયા હણ
હણ શાલુ મેળવાથ દુષ્યા).

- (1) ગાર્ડનુર નગરમાં કાળી મગાવાન કા રજામ હૃતી થા

(2) સેનામાલાને પુરા કા નામ દાયા હું !

(3) રોમાસી દેવબંદન વિચારું કિટની વાર તીવી !

(4) કાળી મગાવાન કાણ કાયા ૬૫ દિનુખ કરી હું .

(5) કાળી મગાવાન કાણ માતા કા નામ સિદ્ધાર્થા હું

(6) પ્રશ્ન મકાલીર કાણ દીઝા કાળી ગાંડ મોહુર થી

7 ૧૦ લોચાય વિચારું આચુ કિટસથા હું

8 દેખરેખ રાજા પુરા કરોળ હું !

9 પ્રશ્ન વિચારણે કો તથ છુરા કિટસર હોતા હું !

10 રામવસરાણ મેં દેવો પુણપુરુષું કિટની ફરણે હું !

11 કાળી મગાવાન કા માતા, પ્રિતા, કાણામ સામાન હું

12 દાયા, માતાનું પુરા કા નામ દાયા હું

13 કાળી મગાવાન કા પિતા જીએ માનુ હું !

14 શુદ્ધિન રાજા કા પરિણ કા નામ દાયા હું

15 કાણાલ નગરી અંશી કાળી નસી મગાવાન જી ! દિક્ષાની

16 મગાવાન શુદ્ધિની પુરા કરણેવાળે તીર નિંદે, કરણેવાળેદ્યા ગીતાણી

17 કિટન મગાવાન કા માતા, મોતા અંગાધે

18 ૧૦ દિનુખ કાણ કિસ મગાવાન કા થી

19 શિવરાણાને પુરા કા નામ દાયા થા

20 કાળી નગર કા રાજા કા પરિણ કા નામ દાયા થા

21 કાળી નગરીનું આંતર આંતર નામ થા, કાળી નિદ્રા કાળરિ.

22 વિનિગ, નગરી અંશી કાળી નસી મગાવાન કા જામહુતી થા

23 કામંઅયથે પ્રગાર હું આ અલિદાય કિટન,

24 કુંભુનાય મગાવાન કા આચુ કિટના થા

25 તીર લોચમે રડી હૃતી શાલિયાન પ્રલિન, કિટની હું

26 આંધી આંધી ઉપાંગ કિટન હું

27 શાલિયાન પ્રલિન કા દાર નામ કિટણી

28 ભવનપતિ કા દેખાસર કાણ રાખ્યા કિટની હું

29 મગાવાન વિચારણે સમય કિટની જગા, પર શીગ નડી હોતા

30 કુંભુનાય મગાવાન કા લંઘણ દાયા હું !

31 પ્રશ્ન કા લંઘણદોંગ હું જો વળી દીઠા વો પ્રોનસા પ્રાણી હું !

32 સામદર અંશે કાળી ચિંજ નિદ્રાની હું કા મગાવાન કા લંઘણ હું

33 ૧૫ દિનુખની કાયા કાળસા મગાવાન કા વી

- 34 કોણથી મગાવાન કાંઈકાં રખેલાં હતી હી
- 35 ભિયિકા નગાડી ને કોણ સુટીનું હુંડું
- 36 કોણથી મગાવાન બાંધુંદુંદ્યારી હૈ.
- 37 માગ-પિાળેજો નામ રચ્યા તરફે આજીવા દુસરા નામ હતું ૧૧
- 38 મગાવાન કે અનિશ્ચયો કા વર્ગન રિફસ કિલેમે આતી હું
- ૩૯ કોડીપદ મુજિન મનહૃર પદ કિસમે આતી હું
- ૪૦ રાખ્યાન પ્રતિમા કા વર્ગન કોણસે શાર્ટ-એમે આજી હું
- ૪૧ દેવદંડન મેં કુલ કિલને ચેત્યાદંડન આતી હું
- ૪૨ મામંડલ રિફસનું ઉપર શોભ રડું ૧૧
- ૪૩ સ્થાન વાંદ રિભાડા
- ૪૪ કુંઘુંનાથ મગાવાન કો કોણસાન હુંડી તવ કોણ સા તપ થા।
- ૪૫ પ્રથમ જિન્નેસર કી કાચા કોણી હું
- ૪૬ ભયંકર ડિસેટ હોનું હું અની મગાવાન કાંઈદુન હોનું ૧૧.
- ૪૭ દેવદંડન મેં કુલ રસ્સાવાન રિફાતને આતી હું
- ૪૮ તિરાર જરૂર સુનુદાય કિલને ચોંગન મેં આતી હું
- ૪૯ કોણસે મગાવાન બી કાચા રૂંડ દ્યાનુખ કી હું
- ૫૦ કોણસંબીલુર નગાર કે રાજા કોણ હું
- કોણી ઓર ગાંઠ કિલચ્યા**
- ૫૧ પક્ષીયા મગાવાન કો પ્રદાનિયા દેને ૧૧
- ૫૨ મગાવાન કો કોણી - શીમ - જાથ્યું વઠું હું
- ૫૩ પાદપીઠકી રચના વ્યાંગ દેવાં કરું
- ૫૪ મહાલીર મગાવાન કો થાજાં જામ માલંગ હું
- ૫૫ મનું કે કન્ધાંખાં કો મનુંત્સબ કે કિલું દેવોનંદિશ્વર જિપ રાય
- ૫૬ આદીનાથ મગાવાન કી હી સૌંબળની કાચા હું
- ૫૭ સુપાશ્વનાથ મગાવાન ઓર પાશ્વનાથ મગાવાન વાળારસી કે થ
- ૫૮ રિબલનાથ મગાવાન કા આયું ૬૦ લાખ વર્ષુંની થા।
- ૫૯ વાસુદુર્જય. ની. કા, જન્મ ચંપાયુશી મેં હુંડી થા।
- ૬૦ મગાવાન દેશાંનું વો શાંખમે નારી મરાણી રંગાંની હોંગાં ૧૧
- આનુંન મેં વલાચા હુંડી ૧૦ મગાવાન કા લંઠું કિરબા

(10)

(1)	૭	ન રિ સિ
(2)	૮	શા ન રા લુ કા ર લ દા
૩)	૯	લ ર ચ્ય ૨ રા ન રા લ જો નિધ વો રા
૪)	૧૦	એ ર કુ અ કો ર સિ ર ગ નિ
૫		
૬,		

૨૩ ૨૩ માટેથી

શ્રી અલિનંદન સ્વામીનો નમ:

શ્રી અલિનંદનસ્યામી પ્રભુના સાનિધ્યમાં

૨૧૮૦૨૦ એ ચિલાલીએ જોન રવે. મુ. પુ. સેધ-ઉપક્રમે

અર્થિન્દી-અર્થિન્દી • લોયલ મનુ રૂપદા

પાઠનનિષ્ઠા પ. પુ. વા.- દે. અભિનદ્વિપ, જગાચયંત્રસૂરીમિષણ મ. સા. જ,
શ્રીમાધરાણી સા. પ્રથમદર્શાણ, શ્રી. જી. મ. સા. ચિંતયા.,
પ. પુ. તૃતીયદર્શાણ, શ્રી. જી. મ. સા.

